



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૧/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૧ કેસ કરી, ૩૭ વ્યક્તિઓને ઝડપી, ૬૦૩ લીટર દેશી દારૂ, ૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧ મોટર સાયકલ અને ૨ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૫/૧૯

વાડજ: વિજયભાઈ જેઠાલાલ મકવાણા (ઉ.વ.૫૪)(રહે.વિનસ પાર્ક લેન્ડ વેજલપુર નગરપાલીકા સામે વેજલપુર) એ તા.૦૩/૦૧/૧૯ નારોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૨ થી ૨૦૧૬ સુધીના સમયગાળા દરમ્યાન ઉસ્માનપુરા ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે આર.બી.આઈ.બેંકની બાજુમાં કર્મચારી ભવિષ્યનીધી ભવનની કચેરી ખાતે વિશ્વ એન્ટરપ્રાઈઝ એફ-૫૫ મ્યુ.માર્કેટ મહેસાણા અને બીજી ૦૯ કંપનીના માલીકો/સંચાલકો મળી કુલ ૧૦ કંપનીના માલીકો/સંચાલકોએ ભેગા મળી તેઓની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ.ના નાણાં મેળવવા અંગેના પી.એફ. ફોર્મ તથા તેને અનુરૂપ બીજા જરૂરી દસ્તાવેજો બનાવી તેઓની કંપનીના સહી સિક્કા કરી, વિજયભાઈની કચેરીમાં જમા કરાવી, કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફના પૈસા જે તે કર્મચારીના બેક એકાઉન્ટ નહી પરંતુ બીજા અન્ય વ્યક્તિના બેંકના ખાતમાં જમા કરાવડાવી કુલ રૂપિયા ૨,૨૧,૩૬૨/- મેળવી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.એન.સુથાર ચલાવે છે.

બાપુનગર: ઓમવંતીબહેન વા/ઓ અશોકભાઈ ડાભી (ઉ.વ.૪૬)(રહે.કુવાવાળી ખડકી મંગલાપાર્ક ખાંચો શાહપુર) એ તા.૦૩/૦૧/૧૯ નારોજ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૯/૨૦૧૮ સાજના ૭/૦૦ વાગ્યાના સુમારે બાપુનગર મરઘાફાર્મ રોડ કામદાર ઇન્ડ. એસ્ટેટ શહીદ દરગાહ પાછળ શેડ નં.૫૦ ખાતે આરોપી (૧) સમશાદ ઉર્ફે શમસેર ફરાઇન શેખ (૨) આઝાદ ફરાઇન શેખ અને (૩) દિલશાન ફરાઇન શેખ (તમામ રહે. સરખેજ ભાડાના મકાનમાં) એ ભેગા મળી ઓમવંતીબહેનના દિકરા મુયુર સાથે કરેલ ભાગીદારીના ધંધામાં રૂપિયા ૩,૧૦,૦૦૦/- તથા એક હિરો હોન્ડા મોટર સાયકલનું રોકાણ કરાવ્યા બાદ ભાગીદાર તરીકે નહી રાખી રોકાણ કરેલ નાણા અને મોટર સાયકલ પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.ડી.રાઠોડ ચલાવે છે.

કાઈમ બ્રાન્ય: દીપકભાઈ જવાહરલાલ ચોપરા (રહે. કાર્યશિરોમણી ટાવર પટેલ ડેરીની બાજુમાં ડફનાળા રોડ શાહીબાગ) એ તા.૦૩/૦૧/૧૯ નારોજ કાઈમ બ્રાન્ય ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૭ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન કાલુપુર કોટની રાંગ નેતાજી માર્કેટ પહેલો માળ ઓફીસ નંબર-૨૦ ખાતે આરોપી કે.લક્ષ્મીચંદ નેહચલદાસના નામે વેપાર ધંધો કરતા લક્ષ્મીચંદ નેહચલદાસ રામચંદાની (રહે. સુર્યદીપ ટાવર ગુરુકુળ રોડ ગુરુકુળ) સારંગપુર ન્યુ કલોથ માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર દીપકભાઈ ચોપરા પાસેથી ટુકડે ટુકડે રેડી ફેબ્રીકસ (કાપડ) ખરીદ કરી બાકી નીકળતા રૂપિયા ૬૭,૯૧,૮૨૮/- નહી ચુકવી તેમજ દીપકભાઈના અન્ય બે મિત્ર પાસેથી રૂપિયા ૩,૩૭,૫૧,૨૦૯/- તેમજ રૂપિયા ૨,૬૮,૨૪,૩૭૫/- મળી કુલ રૂપિયા ૬,૭૩,૬૭,૪૧૨/- મત્તાની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વાચ.જી.ગુર્જર ચલાવે છે.

પર્સ ઝુટવી લઈ ગયો:-

સમાચાર યાદી નં.૨૬/૧૯

પાલડી: ચંદ્રીકાબહેન જયેતીકુમાર બ્રેઇટ (રહે.જલતરંગ સોસાયટી, વેજલપુર) એ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૧/૧૯ બપોરના ૪/૪૫ વાગ્યાના સુમારે પાલડી શારદા મંદિર રોડ શ્રેયા ટાવર સામે ધર્મનિષ્ઠ સોસાયટી સામેથી ઓટોરીક્ષામાં બેસી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક અજાણ્યો એક્ટીવા ચાલક પોતાની એક્ટીવા ઓટોરિક્ષા નજીક લાવી ચંદ્રીકાબહેનના ખોળામાંથી પર્સ ઝુટવી લઈ નાસી ગયો હતો. પર્સમાં મોબાઇલ કિંમત રૂપિયા ૫૦૦૦/- અને રોકડ રૂપિયા ૨૦,૦૦૦/- તથા અગત્યના દસ્તાવેજો હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એ.અસારી ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૭/૧૯

નરોડા: કરમશીભાઈ સકાભાઈ રબારી (રહે.કરાઇ ગામ પાણીની ટાંકીની બાજુમાં રબારીવાસ પો.વલાદ તા.જી.ગાધીનગર) એ તા.૦૩/૦૧/૧૯ કલાક ૧૧/૦૦ વાગે નાના ચિલોડા જ્યોતિ હોટેલના ખાયામા પાર્થ બંગલો નંબર-૧ નજીક પોતાની કાર નંબર જીજી.૧૮.એએમ.૯૫૫૫ કિંમત રૂપિયા ૧,૪૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી એક કલાકમાં થઇ હતી. આ અંગેની ફરીયાદ કરમશીભાઈ રબારીએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એન.કે.ડાભી ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૮/૧૯

નારોલ: વિનોદકવર વા/ઓ ગિરધારસિંહ મારવાડી (ઉ.વ.૫૦) (રહે.રાજહંસ પાર્ક શિવાલીકપાર્ક વેરાઇપાર્ક સામે ઇસનપુર નારોલ) તા.૨૮/૧૨/૨૦૧૮ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગેસની સગડી ઉપર રસોઈ બનાવતા હતા ત્યારે ગેસની સગડીની ઝાળ પહેરેલ કપડાને લાગી જતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૩/૦૧/૧૯ કલાક ૫/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી શંકરભાઈ હિરજીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.